


	TCDACL A SPV of MAHA PREIT & THANE MUNICIPAL CORPORATION (Subsidiary of MPBCDC, a Government of Maharashtra undertaking)	
Notice for Inviting Request for Qualification		
<p>TCDACL (SPV) invites Request for Qualification for Appointment of Architectural, Master Planning and Transaction Advisory Consultant (AMTAC) to provide the services for implementation of Urban Renewal Scheme in Thane city, for various URC's.</p> <p>The last date of submission of bids is 21/08/2025.</p> <p>Details of RFQ can be viewed on https://tcdac.in/tcweb/tenders and submitted on https://mahatenders.gov.in.</p> <p style="text-align: right;">Director (Technical) TCDACL</p>		

ASPINWALL AND COMPANY LIMITED CIN: L74999KL1920PLC001389 Registered Office: Aspinwall House, T.C.No. 24/2269 (7), Kawdiar-Kuravankonam Road, Kawdiar, Thiruvananthapuram-695003 Phone: 0471-2738900; Website: www.aspinwall.in; Email: investors@aspinwall.in						
Extract of Financial Results for the quarter ended 30 June 2025						Rs. in Lakhs
Particulars	Standalone			Consolidated		
	For the quarter ended		For the year ended	For the quarter ended		For the year ended
	30 June 2025 (Un-Audited)	30 June 2024 (Un-Audited)	31 March 2025 (Audited)	30 June 2025 (Un-Audited)	30 June 2024 (Un-audited)	31 March 2025 (Audited)
1. Total income from operations	8,892	8371	33,459	9,109	8,516	34,229
2. Net (Loss)/profit for the quarter/year before exceptional items and tax	(450)	407	1,554	(397)	458	1,610
3. Net (Loss) profit for the quarter/year before tax, after exceptional items	(450)	407	1,554	(397)	458	1,610
4. Net (Loss)/ profit for the quarter/year after exceptional items and tax	(366)	327	1,440	(327)	367	1,453
5. Total comprehensive (Loss)/ income for the quarter/ year [comprising of (Loss)/ profit for the quarter/year after tax and other comprehensive (loss)/ income for the quarter/year after tax.	(374)	329	1,395	(336)	369	1,406
6. Equity share capital [Face value of Rs.10 each]	782	782	782	782	782	782
7. Reserves [excluding revaluation reserve] as shown in the audited balance sheet of the year	—	—	17,735	—	—	18,481
8. Earnings per share [of Rs.10 each] [in Rs.] -Basic and diluted [not annualised for the quarters]	(4.68)	4.18	18.42	(4.18)	4.69	18.59

Note:

- The above is an extract of the detailed format of the financial results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results are available on the website of the Stock Exchange, www.nseindia.com and is also available on the Company's website, www.aspinwall.in.
- Prior period/ year figures have been reclassified wherever required to confirm to the classification of the current period/ year.



By Order of the Board

Rama Varma
Managing Director

DIN: 00031890

Kochi
4 August 2025

"To access full results, kindly scan:"

Eris

ERIS LIFESCIENCES LIMITED

Regd. Office: Shivarth Ambit, Plot No 142/2, Ramdas Road Off SBR, Near Swati Bungalows, Bodakdev, Ahmedabad, Gujarat-380054. **Email:** complianceofficer@erislifesciences.com, **Website:** www.eris.co.in
Tel: +91 79 6966 1000, **Fax:** +91 79 6966 1155, **CIN:** L24232GJ2007PLC049867

EXTRACT OF CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2025

[₹ in Crores except per share data]

Particulars	For Quarter Ended (Unaudited)	For Quarter Ended	For Quarter Ended (Unaudited)	For Year Ended (Audited)
	June 30, 2025	March 31, 2025	June 30, 2024	March 31, 2025
Revenue from Operations	773.00	705.30	719.72	2,893.64
Net Profit for the period before tax and exceptional items	161.10	128.87	115.52	488.87
Net Profit for the period before tax and after exceptional items	161.10	128.87	115.52	488.87
Net Profit for the period after tax	125.10	102.35	89.55	374.67
Total Comprehensive Income for the period after tax	124.53	100.40	88.76	371.38
Equity Share Capital (Face Value of ₹1 each)	13.62	13.62	13.61	13.62
Other Equity	NA	NA	NA	2,840.74
Net Worth	3,399.10	3,271.76	3,078.22	3,271.76
Paid-up Debt Capital/Outstanding Debt	2,448.61	2,421.66	2,869.18	2,421.66
Outstanding Redeemable Preference Shares	-	-	-	-
Debt Equity Ratio	0.74	0.76	0.95	0.76
Earnings Per Share (of ₹ 1 each) (not annualised):				
Basic	8.66	6.90	6.11	25.85
Diluted	8.64	6.89	6.10	25.81
Capital Redemption Reserve	0.17	0.17	0.17	0.17
Debt Redemption Reserve	-	-	-	-
Debt Service Coverage Ratio	2.60	2.36	2.21	2.24
Interest Service Coverage Ratio	4.29	3.37	2.91	3.11

Notes :

1 Summary of standalone financial results of Eris Lifesciences Limited:

[₹ in crores except per share data]

Particulars	For Quarter Ended (Unaudited)	For Quarter Ended	For Quarter Ended (Unaudited)	For Year Ended (Audited)
	June 30, 2025	March 31, 2025	June 30, 2024	March 31, 2025
Revenue from Operations	578.64	404.77	456.69	1,697.75
Profit before tax	156.26	41.18	26.82	120.05
Profit after tax	99.99	30.47	17.04	77.39
Total Comprehensive Income (after tax)	99.49	28.88	16.32	74.55

2 The above is an extract of the detailed format of quarterly financial results filed with the stock exchange under Regulation 33 and 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of financial results is available on the stock exchanges websites (www.nseindia.com and www.bseindia.com) and on the company's website www.eris.co.in.

3 For the other line items referred in regulation 52(4) of the Listing Regulations, pertinent disclosures have been made to the Stock Exchange(s) (www.nseindia.com and www.bseindia.com) and can be accessed on the company's website www.eris.co.in.

4 The above results were reviewed by the Audit Committee and approved by the Board at their meeting held on August 05, 2025.

Place: Ahmedabad
Date : August 05, 2025

For Eris Lifesciences Limited

Sd/
Chairman and Managing Director

A:\Factors\331\2

Adfactors/331/25

જય માતાજી
માતાજીની ચૂંદડી બાંધી પ્રારંભ



28
દિવસ પછી

કેપ્સ્યુલ બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરી ટેન્કર હટાવામાં આવ્યું
ગંભીરા બ્રિજ પરથી લટકતું
ટેન્કર સુરક્ષિત રીતે ખસેડાયું

પોરબંદરની વિશ્વકર્મા મરીનના ૭૦ તજજ્ઞોએ કામગીરી પાર પાડી : સ્ટ્રેઈન જેક અને કેબલનો ઉપયોગ પણ કરાયો



ટેન્કર નીચે એક કેપ્સ્યુલ બલૂન લગાવાયું



કેપ્સ્યુલ બલૂનમાં મશીનથી હવા ભરાઈ




બલૂનમાં હવા ભરવાની કામગીરી પૂર્ણ થઈ



બીજે બલૂન નીચે મૂકી હવા ભરવામાં આવી



તસવીરો : કેચુર ભાટિશ
બંને બલૂનમાં હવા ભરાયા બાદ દોરડાથી ખેંચીને ટેન્કરને તૂટેલા ભાગથી બહાર લવાઈ



ગંભીરા બ્રિજ ધરાશય થયા બાદ પાંચ દિવસ સુધી તંત્ર દ્વારા નદીમાંથી મુતદેહ તેમજ નદીના પાણીમાંથી બ્રિજ પરથી ખાબકેલા વાહનો કાઢવાની કામગીરી કરાઈ હતી. જોકે, મુતદેહ પરિજનોને સોંપાયા હતા, પરંતુ ઘટનાની સાક્ષી એવા વાહનોનો કાટમાળ આજે પણ નદીના કિનારા પર પડી રહ્યો છે, જેમાં જીવ બચાવનાર હેલ્મેટ પણ નજરે પડે છે.



સંક્ષિપ્ત સમાચાર

વિવિધ આવાસોની બાકી રકમ ૩૧ ઓગસ્ટ પહેલા ભરી દેવાની રહેશે

વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમએમજીવાય અને પીએમએવાય હેઠળ વિવિધ આવાસ યોજનાઓના લાભાર્થીઓને બાકી રહેતી રકમ ૩૧ ઓગસ્ટ સુધીમાં જમા કરાવવા માટે જાહેર નોટિસ આપવામાં આવી છે. જો લાભાર્થીઓ આ સમયમર્યાદામાં રકમ નહીં ભરે, તો તેમને ફાળવવામાં આવેલા આવાસો રદ કરવામાં આવશે. કોષ્ટક રિશન દ્વારા સચાજીપુરા, ગોત્રી, તાંદલજા, હરણી, સુભાનપુરા, અટલાદરા, વાસણા રોડ અને સમા જેવા વિસ્તારોમાં ઈડબલ્યુએસ અને એલઆઈજી કેટેગરીના આવાસોની પ્રોવિઝનલ ફાળવણી કરવામાં આવી છે.

આવાસોના ફોર્મ ભરવા માટેની સમયમર્યાદા ૩૦ દિવસ વધારી

વડોદરા : વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાઈલી ખાતે ઈડબલ્યુએસ-૨ પ્રકારના આવાસો માટે ફોર્મ ભરવાની સમયમર્યાદા ચોથી વખત લંબાવવામાં આવી છે. હવે અરજદારો ૪ સપ્ટેમ્બર, સોજે ૬ વાગ્યા સુધી એનલાઈન ફોર્મ ભરી શકશે. આ આવાસોની ફોર્મલ રૂ. ૫.૫૦ લાખ નક્કી કરવામાં આવી છે, અને વધુ વિગતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાઈલી ખાતે તૈયાર થનારા ઈડબલ્યુએસ-૨ ટાઈપના આવાસો ફાળવવા એનલાઈન ફોર્મ ભરવાની મર્યાદા એક માસ સુધી લંબાવાઈ છે.

સ્વતંત્રતાનો ઉત્સવ સ્વચ્છતાની સાથે થીમ ઉપર હર ધર તિરંગાયાત્રા યોજાશે

વડોદરા : વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હર ધર તિરંગા, હર ધર સ્વચ્છતા : સ્વતંત્રતાનો ઉત્સવ સ્વચ્છતાની સાથે થીમ આધારીત હર ધર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં તા. ૮મી ઓગષ્ટ સુધી રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર મેકીંગ, તિરંગા પ્રેરીટ આર્ટ્સ, ક્વીઝ સ્પર્ધા, રાખડી મેકીંગ વર્કશોપ અને સ્પર્ધા, વોલ પેઈન્ટીંગ, લેટર ઝુંબેશ વગેરે કાર્યક્રમો યોજાશે. જ્યારે બીજા તબક્કામાં તા. ૯ થી તા. ૧૨ ઓગષ્ટ દરમિયાન તિરંગા યાત્રા અને રેલી, સ્વચ્છતા ઝુંબેશ, ત્રીજા તબક્કામાં તા. ૧૩ થી ૧૫મી ઓગષ્ટ સુધી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

‘હરે કૃષ્ણ’ ના મંત્રોચ્ચાર સાથે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી શરૂ

વડોદરા : જન્માષ્ટમીના પર્વની ઉજવણી વિવિધ રીતે શરૂ થઈ ચૂકી છે. કડી. ચાજંગોન ખાતે ‘હરે કૃષ્ણ’ ના મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિવિધ વિભાગોમાં લોકોએ સાથે મળીને કાર્યક્ષેત્રને પરંપરાગત સજાવટથી શણગાર્યું હતું. પુષ્પમાળાઓની સુગંધ સમગ્ર સ્થળે પ્રસરી રહી હતી, જણે ઉત્સવનો માહોલ સંપૂર્ણપણે જમાવ્યો હતો. આ ઉજવણીની સફળતાએ ખરેખર અમને ઊર્જાથી ભરી દીધા છે. ભવિષ્યમાં પણ આવા સાંસ્કૃતિક ઉત્સવો દ્વારા એક જીવંત યાજ્ઞોત્તર પરિવારનું નિર્માણ કરવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે.

ભારતીય એન્જિનિયર્સે હજી એઆઈમાં ઘણું શીખવાનું બાકી : સીપી ગુર્નાની

વડોદરા, તા. ૫
એમ. એસ. યુનિવર્સિટી દ્વારા પાવરિંગ યુથ પોટેન્શિયલ વિષય પર એક ચર્ચા-સત્રનું આયોજન કરાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ દેશનું નામ રોશન થશે. આ સમગ્ર પ્રક્રિયામાં ગુજરાતના યુવાનોને કલ્પના, નવીનતા અને નેતૃત્વના ગુણોથી સજ્જ કરવાનો હતો. ચર્ચા-સત્રમાં યુનિ.ના વાઈસ ચાન્સેલર પ્રો. (ડો.) ધનેશ પટેલ, ટેક મહેન્દ્રના પૂર્વ સીઈઓ સીપી ગુર્નાની અને વિવેક વાધવા સહિત અન્ય નિષ્ણાતોએ હાજરી આપી હતી. સત્ર બાદ પત્રકારો સાથે વાત કરતાં સીપી ગુર્નાનીએ જણાવ્યું હતું કે, યુવા ઈનક્યુબેટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓએ એકસાથે મળીને રાજ્યના સ્ટાર્ટઅપ્સને ‘સ્કેલ-અપ’ કરીને તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે તૈયાર કરવા જોઈએ. આનાથી શહેર, રાજ્ય અને દેશનું નામ રોશન થશે. આ સમગ્ર પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નું જ્ઞાન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. જોકે, ભારતીય એન્જિનીયર્સ હજી પણ એઆઈનું શિક્ષણ મેળવવાની જરૂર છે. તો વિવેક વાધવાએ જણાવ્યું હતું કે, એઆઈ વ્યક્તિની જગ્યા લઈ શકે તેમ નથી પરંતુ તેના ઉપયોગથી વ્યક્તિ વધુ સચોટ રીતે કામ કરતો થાય છે.

કૃત્રિમ તળાવોમાંથી ૨૦ ટન જેટલો ઓર્ગેનિક કચરો એકત્ર કરાયો, કચરામાંથી ખાતર બનાવાશે

વડોદરા, તા. ૫
શહેરમાં દશમાના વ્રતની આસ્થાભરે ઉજવણી કર્યા બાદ દશમા દિવસે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૬ કૃત્રિમ તળાવો મળી ૮ તળાવોમાં મૂર્તિ વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિસર્જન દરમિયાન ફૂલ, પણ, નારિયેળ સહિતનો કચરો અલગ ભેગો કરવામાં આવ્યો હતો. આ કચરામાંથી હવે ખાતર બનાવવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દશમાની મૂર્તિઓના વિસર્જન માટે બનાવેલા કૃત્રિમ તળાવોમાંથી ૨૦ ટન જેટલો ઓર્ગેનિક કચરો એકત્ર કરવામાં આવ્યો છે. આ કચરામાં ફૂલ, પાન, નાળિયેર અને કળાના પાનનો સમાવેશ થાય છે. આ કચરાનો ઉપયોગ સેન્ટ્રીયલ ખાતર બનાવવા અને બાયોગેસ પ્લાન્ટ માટે કરવામાં આવશે.

MSU કમ્પ્યુટર સેન્ટરના ડાયરેક્ટર અને ડે. ડાયરેક્ટરનું અચાનક રાજીનામું

વડોદરા, તા. ૫
એમ. એસ. યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરના ડાયરેક્ટર અને ડે. ડાયરેક્ટર અચાનક રાજીનામું આપ્યું છે. જેની પાછળનું કારણ સ્ટુડન્ટ પોર્ટલ અને એપ્લીકેશનની સર્વિસને ૫ ઈય વર્ષનો સમય થઈ ગયો છે. જે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. જેના આધારે બજેટ સહિતની ફાળવણી કરવામાં આવી હતી. આજે સ્ટુડન્ટ પોર્ટલ અને એપ્લીકેશનના સંચાલન માટે ૧૬ કર્મચારી ફરજ બજાવે છે. જેમને માસિક રૂ. ૪ લાખથી વધારે પગાર આપવામાં આવી રહ્યો છે. જોકે, પાંચ વર્ષની સમયમર્યાદા પૂર્ણ થયે લગભગ છ મહિના જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં તેને રીન્યુ કરવામાં આવી રહ્યો નથી. જેના કારણે ૧૬ કર્મચારીના પગારનો પણ પ્રશ્ન ઉભો થઈ શકે છે. એવા સંજોગોમાં મુરકેલીઓ ઉભી થઈ શકે છે.

ગુજરાત@૨૦૩૦ તથા ભારત@૨૦૪૭ થીમ ઉપર મહાનગરપાલિકા કાર્યકરશે

વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ ૧૭ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને આવરી લેતો એક શહેર-વ્યાપી પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ તમામ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ભારત સરકારના વિકસીત ભારત ૨૦૪૭ની થીમ સાથે સુસંગત છે. વર્ષ

૨૦૧૫માં યુએન દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના વિવિધ ૧૭ આયામો રજૂ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૩૦ સુધીમાં વિવિધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ માનવજાત માટે કઈ રીતે લાગુ કરી શકાય તે માટે રોડમેપ દર્શાવવામાં આવ્યો હતો.

INOX India Limited

Regd. Office: 9th Floor, K P Platina, Race Course, Vadodara - 390007
Tel: (+91 265) 6160100, CIN: L99999GJ1976PLC018945,
Email: secretarial.in@inoxcva.com, Website: www.inoxcva.com

INOXCVA®

HISTORICALLY FUTURISTIC

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30th JUNE, 2025

₹ in Lakhs

Sr. No.	Particulars	Quarter ended June 30, 2025 (Unaudited)	Quarter ended June 30, 2024 (Unaudited)	Year ended March 31, 2025 (Audited)
1	Total Income from Operation	35,229	30,178	1,35,384
2	Net Profit/(Loss) for the period (before Tax, exceptional and/or extraordinary Items)	8,051	6,793	29,175
3	Net Profit/(Loss) for the period before Tax (after exceptional and/or extraordinary Items)	8,051	6,793	29,892
4	Net Profit/(Loss) for the period after Tax (after exceptional and/or extraordinary Items)	6,112	5,264	22,603
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	6,092	5,124	22,400
6	Paid-up Equity Share Capital (Face Value ₹2 per share)	1,815	1,815	1,815
7	Reserves (excluding Revaluation Reserve)	89,927	68,235	85,554
8	Earning per share (Face value of ₹2 per share)*			
- Basic		6.73	5.80	24.90
- Diluted		6.71	5.78	24.83

*Not annualised

Notes :

1 The above results have been reviewed and recommended by the Audit Committee at its meeting held on August 4th, 2025 and approved by the Board of Directors at its meeting held on August 4th, 2025. The Statutory Auditors of the Company have carried out the Limited review of the above results and have issued their unmodified review report.

2 The above results are an extract of the detailed format of Quarterly Financial Results filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of unaudited Quarterly Standalone and Consolidated Financial Results are available of the Stock Exchanges' website (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website (www.inoxcva.com).

Information on Standalone Financial Results:


₹ in Lakhs

Sr. No.	Particulars	Quarter ended June 30, 2025 (Unaudited)	Quarter ended June 30, 2024 (Unaudited)	Year ended March 31, 2025 (Audited)
1	Total Income from Operation	33,987	29,740	1,34,255
2	Net Profit for the period before tax (after Exceptional Items)	7,995	6,850	30,033
3	Net Profit for the period after tax (after Exceptional Items)	6,040	5,321	22,508

KEY HIGHLIGHTS FOR Q1 FY 2025-26

- Received approval for SS Keg from Heineken, the Second Largest Breweries in the World
- First order of its kind received for CO2 battery storage application in India
- Launched India's first ultra-high-purity Ammonia ISO tank container for semiconductor and Solar sectors
- Received Orders of Disposable Cylinder for bulk Qty from US Customers even after imposition of Tariff
- Received FE Mobility Award for excellence in Auto Parts & Comp Manufacturing for LNG Fuel Tanks & for Excellence in H2 Mobility
- Large value order received from ITER for repair of Cryostat Thermal Shield

Place : Village Moti Bhadol, Savli, Vadodara
Date : August 4th, 2025



On behalf of the Board of Directors
For INOX India Limited
Parag Kulkarni
Executive Director
DIN: 00209184